



ॐ

Oshwal Association of the U.K

ગુણ: /100

પ્રશ્નપત્ર તારીખ: ૨૧.૦૨.૨૦૨૨

પરત તારીખ: ૩૦.૦૪.૨૦૨૨

Full Name: E Mail

Tel No: Home Mobile

Address:

પ્રશ્નોત્તર રત્નમાલા

વીર પ્રભુના જીવન પર આધારિત નીચેનાં પ્રશ્નોના જવાબ અ ઉપરથી આપો

૧	પ્રભુ વીર બાળપણમાં કઈ રમત રમતા હતાં?.....	1
૨	શુભપાણી યજ્ઞ વેરેલા વિનાસથી થયેલા હાડકાના ઢગલા ઉપરથી ગામનું નામ શું પડ્યું?	1
૩	પ્રભુને બીજા માસક્રમણનું પારણું કોણે કરાવ્યું હતું?	1
૪	પ્રભુએ સાતમું ચાતુર્માસ કયા નગરમાં કર્યું હતું?.....	1
૫	પ્રભુનાં પારણા સમયે આકાશમાંથી કયો જયઘોષ થયો હતો?	1
૬	પ્રભુએ સંઘની સ્થાપના કઈ નગરીમાં કરી હતી?	1
૭	પ્રભુએ ચારમાસી તપનું પારણું શાનાથી કર્યું હતું?	1
	નીચે આપેલા દરેક પ્રશ્નોના જવાબ 'વ' ઉપરથી આપો.	
૮	શત્રુજય પર્વત પર ૪૪૦૦ શિષ્યો સાથે મુક્તિ પદને પામનાર પુણ્યાત્મા કોણ?	1
૯	રાજગૃહિ તીર્થમાં એક પર્વતનું નામ લખો	1
૧૦	છ આવશ્યકમાંથી એક આવશ્યકનું નામ શું છે?.....	1
૧૧	કયા પ્રકારના દેવના ૭૬ ભેદ હોય છે?.....	1
૧૨	અભ્યંતર તપના એક પ્રકારનું નામ શું છે?	1
૧૩	બાર વ્રતધારી શ્રાવકનું એક લક્ષણ કયું?	1
૧૪	પચ્ચીસ પ્રકારની ક્રિયામાંથી એક ક્રિયાનું નામ શું?	1
	સામાયિક	
	સામાયિક આવશ્યકને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો.	
૧૫	છ આવશ્યકમાંથી સામાયિકને પ્રથમ સ્થાન શા માટે અપાયું છે?	1
૧૬	સામાયિક કેટલામું વ્રત છે?	1

૧૭	સામાયિક લેવાની અને પારવાની વિધિમાં કેટલાં ખમાસમણા આવે?	2
૧૮	સામાયિકમાં કેટલા પ્રકારે સ્વાધ્યાય થાય?	1
૧૯	સામાયિકના પ્રતિજ્ઞા સૂત્ર દ્વારા ગુરુ ભગવંત કેવા પચ્છકખાણ લે છે?	2
૨૦	કાળ અને ભાવના અર્થમાં સામાયિકને સમજાવો. કાળ..... ભાવ	2
	સૂત્ર સરગમ	
૨૧	એકપણ જોડા અક્ષર વિનાનું સૂત્ર?	1
૨૨	સ્થૂલભદ્રજીની બહેનોનાં નામ..... સૂત્રમાં છે.	1
૨૩	શ્રાવકે કુલ અતિયારોના મિચ્છામિ દુક્કડમ માગવાના હોય છે.	1
૨૪	નમુત્યુણં સૂત્રના કુલ અક્ષરો છે.	1
૨૫	સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં મિશ્રિત સૂત્ર છે.	1
૨૬	ચૌદ સ્વપ્ન અને અષ્ટમંગલ બન્નેમાં કઈ વસ્તુ એકસરખી હોય છે?	1
૨૭	ચઉવિહારના પચ્ચકખાણમાં આગાર છે. સંખ્યા લખો.	1
૨૮	નાનામાં નાનું સૂત્ર છે?	1
૨૯ સૂત્રના રચિયાતા સિદ્ધસેન દિવાકર છે.	1
૩૦	બાર તપનાં નામો સૂત્રમાં આવે છે.	1
	કરું છું પ્રેમ વંદના	1
૩૧	કીડીઓની રક્ષા કરવા કડવી તુંબડીનું શાક આરોગી ગયા. (મેતારજ મુનિ, ધર્મરુચિ અણગાર, મેઘરથ રાજા)	1
૩૨	કૌંચ પક્ષીની રક્ષા કરવા મૌન રહ્યા. (મેતારજ મુનિ, ધર્મરુચિ અણગાર, મેઘરથ રાજા)	1
૩૩	પારેવાની બચાવવા પોતાનું શરીર આપવાનીએ તૈયારી બતાડી. (મેતારજ મુનિ, ધર્મરુચિ અણગાર, મેઘરથ રાજા)	1
૩૪	કેવળજ્ઞાન પામ્યા પછી પણ છ મહિના માતાપિતાની સેવા કરી. (મૃગાપુત્રે, કુર્માપુત્રે, ચિલાતીપુત્રે)	1
૩૫	પ્રભુ મહાવીરદેવનું નિર્વાણ રોતાં બાળકની જેમ રડી પડ્યા. (સુધર્માસ્વામી, ગૌતમસ્વામી, નંદીવર્ધન)	1
૩૬	પ્રભુ મહાવીરદેવના ચોમાસી તપનું પારણું કરાવવાની શેઠ રોજ ભાવના ભાવતા હતા. (અભિનવ, નગર, જીરણ)	1
૩૭	આ અવસર્પણી કાળમાં પ્રથમ ગણધર થયા. (ગૌતમસ્વામી, વરદત્તસ્વામી, પુંડરીકસ્વામી)	1
૩૮ એ દીક્ષા લેવા માટે ૬૦.૦૦૦ વર્ષ સુધી આયંબિલ કર્યા. (તામલી, સુંદરી, બ્રાહ્મી)	1

૩૯	પાંચમા આરાના અંતે છેલ્લાં આચાર્ય થશે. ચંદ્રસેસૂરિજી, યશોબદ્રસૂરિજી, દુષ્પસહસૂરિજી	1
૪૦	આ અવસર્પિણીકાળમાં સૌથી છેલ્લે મોક્ષે ગયા. (સ્થૂલભદ્રજી, ભદ્રબાહુસ્વામી, જંબુસ્વામી)	1
૪૧	શત્રુંજય પર નંદીશ્વર દ્વીપની ટૂંકએ બનાવી છે. (પ્રમચંદ મોદી, કર્માશા, ઉજમફોઈ)	1
૪૨	શ્રેણિક રાજાના પૌત્ર પણ તીર્થંકર બનશે. (અભય, કોણિક, ઉદયન)	1
૪૩	શ્રેણિક રાજા આવતી ચઉવીસીમાં તીર્થંકર થશે. (છેલ્લા, પહેલા, બારમા)	1
૪૪	ગૌતમસ્વામીશ્રાવકને મિચ્છા મિ દુક્કડં દેવા ગયા. (કામદેવ, મહાશતક, આનંદ)	1
૪૫	શ્રેણિકરાજામુનિના સમાગમથી સમકિત પામ્યા. (શાલિભદ્ર, અનાથી, સિંહ)	1
૪૬	પન્નિની ટકોર સાંભળીને એ તરત દીક્ષા લીધી. (ધન્નાજી, શાલિભદ્રજી જમાલી)	1
૪૭	નવકારશી વાપરતાંમુનિ કેવઉજ્ઞાન પામ્યા. (હરિકેશી, અઈમુત્તા, કુરગડ)	1
૪૮	પ્રભુ મહાવીરદેવના કાનમાંથીવૈદ્યે ખીલા કાઢ્યા. (જીવક, જીવાનંદ, ખરક)	1
	કાઉસ્સગ્ગ	
૪૯	કાઉસ્સગ્ગના એક શ્વાસોશ્વાસમાં કેટલા પદ ગણાય?	1
૫૦	કાઉસ્સગ્ગ કઈ કઈ મુદ્રામાં થાય?	1
૫૧	કાઉસ્સગ્ગ પૂર્ણ થયાની બીજાને કેવી રીતે ખબર પડે?	1
૫૨	કાઉસ્સગ્ગમાં કેટલા દોષોનો ત્યાગ કરવો જોઈએ?	1
૫૩	પક્ષિ પ્રતિક્રમણમાં કેટલા શ્વાસોશ્વાસ કાઉસ્સગ્ગ કરવાનો હોય છે?.....	1
૫૪	કાઉસ્સગ્ગ કરતી વખતે કેટલી છૂટો રાખવામાં આવે છે?	1
	સ્નાત્રપુજા	
૫૫	તીર્થંકર પ્રભુનો જન્મભિષેક ઊજવીને દેવતાઓ ક્યાં જાય છે?	1
૫૬	સ્નાત્રપૂજા ભણાવવાથી શું પવિત્ર બને છે?	1
૫૭	ઇન્દ્ર કયા કર્મનું ઉપાર્જન કરીને પાપનો નાશ કરે છે?	1
૫૮	સ્નાત્રપૂજા એ કઈ પૂજા છે?	1
૫૯	સ્નાત્રપૂજા ક્યારે ભણાવી જોઈએ?	1
૬૦	પ્રભુની અભિષેકનું વિધાન શેમાં શેમાં આવે છે? કોઈ પણ ત્રણ નામ આપો. ૧.....અષ્ટોત્તરી સ્નાત્ર..... ૨..... ૩..... ૪.	3
	આરાધના કરીએ સાચી સાચી	
	નીચેના વાક્યો ઉચિત કે અનુચિત તે જણાવો.	
૬૧	રૂપા પોતાની એક પણ આરાધના ડોહળાય નહિ તે રીતે તપ કરે છે.	1

૬૨	સંજનાબહેન પુત્રવધુને પૂજણીથી પ્રમાર્જના કરીને જ ચૂલો પેટાવવાનું શિક્ષણ આપે છે.	1
૬૩	હરીશે શાસનદેવીની પૂજા અનામિકા આંગળીથી કરી.	1
૬૪	નમન રોજ ઉકાળેલું પાણી પીએ છે.	1
૬૫	રાજલબહેન ફૂલોને ગૂંથીને હાર બનાવી પુષ્પપૂજા કરી.	1
૬૬	કેવિન રોજ સૂર્યાસ્ત પહેલાં ચોવિહારનું પચ્છકખાણ લે છે.	1
૬૭	જયનાબહેને જૂનાં કપડાં વેચવાના બદલે ગરીબોને આપ્યા.	1
૬૮	ભગવાનના દર્શન થતાં જ નયના બે હાથ જોડી નિસિહી બોલી.	1
૬૯	દર્શન કરવા આવેલાં બધાં ભાઈ-બહેનોને સાધ્વીજી મહારાજે વાસક્ષેપ કર્યો.	1
૭૦	ચૈત્યવંદન એટલે શું?	3
૭૧	ચૈત્યવંદના કેટલા પ્રકારો છે? અને તેના વિશે ટૂંકમાં જણાવો?	18
૭૨	ગુરુવંદન કરવાથી શું લાભ થાય? ૧.....વિનય આવે..... ૨..... ૩..... ૪. ૫..... ૬.મોક્ષની પ્રાપ્તિ થાય.....	4
		૧૦૦
●	ખાસ નોંધ:	
●	આપનું પ્રશ્નપત્ર પરત તારીખ બાદ વધુમાં વધુ દશ દિવસમાં મોકલી આપશો.	
●	પ્રશ્નપત્ર ઉપર આપનું પૂરું નામ, સરનામું, ઇ-મેઇલ અને ઘરનો તથા મોબાઇલ ટલિફોન નંબર લખશો.	
●	પ્રશ્નપત્રમાં જવાબ બ્લૂ અથવા કાળી પેનથી લખવા વિનંતિ.	
	પ્રશ્નપત્ર ટપાલ દ્વારા પાછું મેળવવા, તમારું <u>પૂરું નામ, સરનામું અને મોટા કવરની સ્ટેમ્પ લગાવેલ કવર</u> સાથે મોકલી આપશો અથવા ઇ-મેઇલ દ્વારા મોકલી શકો છો.	
	OAK Religious Team	
	105 Arlington Road	
	Southgate,	
	London, N14 5BA	
	Tel: 07958 447298 / 020 8368 4791	
	Email - jainism @oshwal.org	